

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૮/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૯૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૨૭૯ લીટર દેશી દારૂ, ૪૯૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૪૪ બિયર ટીન, ૩ કાર, ૧ રીક્ષા અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧૧ કેસ કરી ૭૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨,૭૯,૧૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૯૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૮ વ્યક્તિઓઓની અને પાસા હેઠળ ૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૫૯૪/૧૮

સરદારનગર: મયંકભાઈ નશીકાંત માછરેકર (રહે,ફી કોલોની છારાનગર કુબેરનગર) તા.૧૬/૮/૧૮ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે રાજાવીર સર્કલ પાસે આવેલ શાંતીપ્રકાશ હોસ્પિટલ આગળ આવેલ વળાંક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ મયંકભાઈના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ મયંકભાઈ માછરેકરે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૫૯૫/૧૮

નિકોલ: વિશાલ હેમંતભાઈ ધાનેકર (ઉ.વ.૨૦) (રહે. આગળ એવન્યુ રોયલ બંજ્લોઝ બાજુમા મનોહરવીલા પાસે નરોડા રોડ નિકોલ) એ અગમ્ય કારણસર તા.૧૬/૮/૧૮ સવારના થી સાજના ૭/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અક્સ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો ઈપસંગજી ઉદાજી ચલાવે છે.

અમરાઈવાડી: મુર્ગેશ ઉર્ફે બટકો મદ્રાસી (રહે.રામચંદ દાદાની ચાલી સુર્યનગર અંબીકા રોડ હટકેશ્વર અમરાઈવાડી) એ બિમારીથી કંટાળી તા.૧૭/૮/૧૮ સવારના ૧૦/૩૦ વાગ્યાના સુમારે દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરતી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રાજેન્દ્રકુમાર આત્મારામ ચલાવે છે.

મણીનગર: ચંદ્રીકાબહેન વા/ઓ હરેશભાઈ પટેલ (ઉ.વ.૪૫) (રહે.સુષ્ટી વિભાગ-૪ પરીમલ હોસ્પિટલ પાસે ઝઘડીયા બ્રીઝ પાસે મણીનગર) એ અગમ્ય કારણસર તા.૧૬/૮/૧૮ બપોરના ૨/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે મણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન.પરમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.